Seat	No.	:	
Den.	7 100		

AH-110

April-2022

M.Com., Sem.-IV

508-EA/EB/EC/ED: Taxation-II

(Corporate Tax Planning and Goods and Service Tax)

(New)

(A) કંપનીનો રહેઠાણનો દરજ્જો સમજાવો. 2. (A) વસ્તુઓ અને સેવા કર (GST)ના કાયદા હેઠળ "ઘંઘો" અને "વસ્તુ" સમજાવો. (B) વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો. 3. (A) ટૂંકનોંધ લખો : વસ્તુઓ અને સેવા કર કાઉન્સિલ (પરિષદ) (GST Council) (B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 4. (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસ્થળ" અને "પૂર્તિસમય" સમજાવો. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) [1] [2] [3] [4] [5] [6] [6] [6] [6] [7] [6] [7] [8] [8] [8] [8] [8] [8] [8] [8] [8] [9] [9] [9] [9] [9] [9] [9] [9] [9] [9	Time	[Max. Marks: 50		
કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપો : 1. (A) કંપનીના કર આયોજનને અસર કરતાં પરિબળો સમજાવો. (B) કંપનીનો રહેઠાણનો દરજજો સમજાવો. 1. (A) વસ્તુઓ અને સેવા કર (GST)ના કાયદા હેઠળ "ઘંઘો" અને "વસ્તુ" સમજાવો. (B) વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો. 1. (B) વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો. (B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 4. (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસ્થળ" અને "પૂર્તિસમય" સમજાવો. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) (B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવધ કરમુક્તિઓની ચર્ચા કરો. 1. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) (C) પરેલુ અને સેવા કર છે છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ હેપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની	સૂચના	ઓ :	(2) વિભાગ-I માં કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપો.	
1. (A) કંપનીના કર આયોજનને અસર કરતાં પરિબળો સમજાવો. (B) કંપનીનો રહેઠાણનો દરજ્જો સમજાવો. 2. (A) વસ્તુઓ અને સેવા કર (GST)ના કાયદા હેઠળ "ધૂંધો" અને "વસ્તુ" સમજાવો. (B) વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો. 3. (A) ટૂંકનોંધ લખો : વસ્તુઓ અને સેવા કર કાઉન્સિલ (પરિષદ) (GST Council) (B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 4. (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસથળ" અને "પૂર્તિસમય" સમજાવો. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) [Qભાગ-II 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (ફોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર હેઠ (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસેયેટ કંપની (B) શાસક કંપની			વિભાગ-I	
(B) કંપનીનો રહેઠાણનો દરજ્જો સમજાવો. 2. (A) વસ્તુઓ અને સેવા કર (GST)ના કાયદા હેઠળ "ઘંઘો" અને "વસ્તુ" સમજાવો. (B) વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો. 3. (A) ટૂંકનોંધ લખો : વસ્તુઓ અને સેવા કર કાઉન્સિલ (પરિષદ) (GST Council) (B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 4. (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસ્થળ" અને "પૂર્તિસમય" સમજાવો. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) [Qભાગ-II] 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની		કોઈપ		
2. (A) વસ્તુઓ અને સેવા કર (GST)ના કાયદા હેઠળ "ઘંઘો" અને "વસ્તુ" સમજાવો. (B) વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો. 1 3. (A) ટૂંકનોંધ લખો : વસ્તુઓ અને સેવા કર કાઉન્સિલ (પરિષદ) (GST Council) (B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 1 4. (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસ્થળ" અને "પૂર્તિસમય" સમજાવો. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) [amin-II 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની	1.	(A)		10
(B) વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો. (A) ટૂંકનોંધ લખો : વસ્તુઓ અને સેવા કર કાઉન્સિલ (પરિષદ) (GST Council) (B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 4. (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસ્થળ" અને "પૂર્તિસમય" સમજાવો. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) [Amu-II] 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (ફોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની		(B)	કંપનીનો રહેઠાણનો દરજ્જો સમજાવો.	10
(B) વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો. (A) ટૂંકનોંધ લખો : વસ્તુઓ અને સેવા કર કાઉન્સિલ (પરિષદ) (GST Council) (B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 4. (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસ્થળ" અને "પૂર્તિસમય" સમજાવો. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) [Amu-II] 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (ફોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની	2.	(A)	વસ્તુઓ અને સેવા કર (GST)ના કાયદા હેઠળ "ધંધો" અને "વસ્તુ" સમજાવો.	10
(B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 4. (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસ્થળ" અને "પૂર્તિસમય" સમજાવો. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) • વિભાગ-II 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની			વસ્તુ અને સેવા કરના કાયદાની વિશેષતાઓ સમજાવો.	10
(B) વસ્તુ અને સેવા કર હેઠળ વિવિધ કરમુક્તિઓની ચર્ચા કરો. 4. (A) વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસ્થળ" અને "પૂર્તિસમય" સમજાવો. (B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) • વિભાગ-II 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની	3.	(A)	ટુંકનોંધ લખો : વસ્તુઓ અને સેવા કર કાઉન્સિલ (પરિષદ) (GST Council)	10
(B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) (Qmin-II 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની			Carling Comment Constitution	10
(B) ટૂંકનોંધ લખો : નિવિષ્ટ કર જમા (પરત) (Input Tax Credit) (Qmin-II 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની	4.	(A)	વસ્તુ અને સેવા કરના કાયદા હેઠળ "પૂર્તિસ્થળ" અને "પૂર્તિસમય" સમજાવો.	10
5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની				10
5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) (1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની			Gaust II	
(1) વસ્તુ અને સેવા કર એ છે. (A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ (2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની	5	ופרונ		10
(A) પરોક્ષ કર (B) પ્રત્યક્ષ કર (C) સેસ (D) આ બધા જ એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની	5.			
(2) એટલે એવી કંપની કે જેના પર અન્ય કંપની મહત્ત્વની અસર ધરાવતી હોય પણ જે ગૌણ કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની		(1)	(D)	આ બધા જ
કંપની નથી, જેમાં સંયુક્ત સાહસ કંપનીનો પણ સમાવેશ થાય છે. (A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની		(2)		ી હોય પણ જે ગૌણ
(A) એસોસિયેટ કંપની (B) શાસક કંપની		1-/		
2 · 0			2222 1 0	
	U	1	2 . 0	
AH-110 P.T.	AH-	110	1	P.T.O.

(3)		માળખાની રચ કારક બને છે,	નામાં નાણાકીય લી જ્યારે	વિરેજનો ઉપય	યોગ કંપની માટે કર	ની જવાવ	મદારીના સંદર્ભમાં	
	(A)		જ્યાર ળતરનો દર, ઉછીન	ા લીધેલ મડી	પર વ્યાજના દર કર	તાં વધારે	હોય ત્યારે	
	(B)		ળતરનો દર, ઉછીર્ન					
	(C)	રોકાણ પર વ	ળતરનો દર, ઉછીર્ન	ો લીધેલ મૂડી	પર વ્યાજના દર જે	ટલો હોય	ત્યારે	
	(D)	આમાંથી કોર્દ		6				
(4)	ધંધાન	2-	વરૂપ એ કંપની સ્વરૂ	પ છે.				
(')	(A)	સહકારી મંડ	,	(B)	ભાગીદારી પેઢી	+		
	(C)	હિન્દુ અવિભ	ાક્ત કુટુંબ	(D)	આમાંથી કોઈ નહીં			
(5)	અંતર	રાજ્ય (બે રાજ	યો વચ્ચે) વસ્તુઓ	અને સેવાઓન	ની પૂર્તિ માટે	_ વસૂલ	કરવામાં આવે છે.	
	(A)	સંકલિત વસ્ત્	યુઓ અને સેવાઓ વે	ોરો (IGST)				
	(B)	-	ઓ અને સેવાઓ વે	100				
	(C)	રાજ્ય વસ્તુચ	મો અને સેવાઓ વેરે	(SGST)		47		
	(D)	આ બધા જ						
(6)	ભારત	ામાં વસ્તુઓ ર	મને સેવાઓ પરના ^ર	વેરાની શરૂઆ	ત વર્ષે	નાં કરવામ	ાં આવી.	
	(A)	2017	(B) 2016	(C)	2018	(D)	2019	
(7)	वस्तुः	બો અને સેવા ^ર	મોની પૂર્તિ પરનો વેર	ો "વસ્તુ અને			ખાધારિત છે.	
	(A)	ગંતવ્ય સ્થાન	(Destination)	(B)	વિકાસ (Develop			
	(C)	ઉત્પાદન (P	roduction)	(D)	ઉપભોગ (Consu	mption))	
(8)	વસ્તુઃ	ઓ અને સેવા ^ર	વેરા (GST) ના કાર	ણે	_ વેરાઓ રદ કરવાર	માં આવ્ય	l.	
	(A)	સેવા કરો		(B)	આવકવેરો			
	(C)	કંપની પરનો	વેરો	(D)	આ બધા જ			
(9)	वस्तु	અને સેવા વેરા	ની કરપાત્રતા	ને આધ	યારે નક્કી કરવામાં ર			
	(A)		ાવાની પૂર્તિનું સ્થળ	(B)	વસ્તુ અને સેવાની	પૂર્તિનો સ	તમય	
	(C)	વસ્તુ અને સે	ાવાનું મૂલ્ય	(D)	આ બધા જ			
(10)	वस्तु	અને સેવા વેરા	ના દરો	્રકારા નક્કી ક	રવામાં આવે છે.			
	(A)	ભારતના ના	ણાપ્રધાન	(B)	રિઝર્વ બેંક ઑફ ઈ		•	
	(C)	ભારતના વડ	ાપ્રધાન	(D)	જી.એસ.ટી. કાઉ	ન્સેલ (પ	ારિષદ)	
(11)		पर वर	ત્તુ અને સેવા વેરો ((GST) લાગુ પ				
	(A)	તમાકુ	(B) સોનું	(C)	બેન્ક ચાર્જીસ	(D)	પેટ્રોલ	
(12)	वस्तु	અને સેવા વેરા	નો આખરી બોજ _	પ	ર પડે છે.			
	(A)	ઉત્પાદક	(B) છુટક વેપારી	(C)	સરકાર	(D)	આખરી ઉપભોક્તા	

Seat I	No.	:	

AH-110

April-2022

M.Com., Sem.-IV

508-EA/EB/EC/ED: Taxation-II

(Corporate Tax Planning and Goods and Service Tax)

(New)

Time: 2	[Hours]				[Max. Marks: 50
Instruct	ions: (1)	All questions in Sect	ion-I carry	equal marks.	
	(2)	Attempt any two que	estions in Se	ection – I.	
	(3)	Question No. 5 in Se	ection – II i	s compulsory.	
A 4			CTION – I		
		vo questions :			
1. (A		actors affecting Tax P		Company.	10
(B)) Explain F	Residential status of a	Company.		10
2. (A) Explain "	Business" and "Goods	s" under GS	TAct	10
(B)		alient features of GST			10
	1				10
3. (A)	Write a sl	hort note on : GST Co	uncil.		10
(B)	Discuss v	arious exemptions fro	m GST.		10
4. (A)	Explain, '	"Place of Supply" and	"Time of S	upply" under GST Ac	t. 10
(B)		nort note on : Input Ta			10
		SEC	CTION - II		
5. Sel	ect correct a	lternative. (Attempt an	ny five)		10
(1)	GST is _				
	(A) Indi	irect tax	(B)	Direct tax	
	(C) Ces	s	(D)	All of these	
(2)					
(2)	A compar	y in which that other	company h	as a significant influer	nce, but which is
	ioint vent	sidiary company of thure company is	e company	having such influence	e and includes a
		ociate Company	—,	Halding Comment	
		sidiary Company	(B)	Holding Company	
	(C) Sub	sidially Company	(D)	Limited Company	
AH-110			3		P.T.O.
			1		

(3)		Rate of Return on Investment in Return on Investment i	s highe	of Capital Structure is beneficial in er than rate of interest on borrowings. han rate of interest on borrowings. to the rate of interest on borrowings.
(4)		form of business is corpora	te form	of business.
()	(A)	Co-operative Society	(B)	Partnership firm
	(C)	HUF	(D)	None of these
(5)	For I	nter-State Supply of Goods and	Servic	es is levied.
	(A)	IGST	(B)	CGST
100	(C)	SGST	(D)	All of these
(6)	GST	was introduced in India in the y	vear	
(0)	(A)	2017	(B)	2016
	(C)	2018	(D)	2019
	(-)		. ,	
(7)	GST	on supply of Goods and Service	es is ba	
	(A)	Destination	(B)	Development
	(C)	Production	(D)	Consumption
(9)	Whi	ch of the following tax was abol	lished d	tue to GST ?
(8)	(A)	Service Tax	(B)	Income Tax
	(C)	Corporate Tax	(D)	All of these
	(0)	Corporate Tan		
(9)	Taxa	ability of GST is decided on the	basis o	f
	(A)	Place of supply of Goods and	Service	S
	(B)	Time of supply of Goods and		
	(C)	Value of supply of Goods and	Servic	es
	(D)	All of these		
(10)	Rate	es of GST are decided by		
()	(A)	Finance Minister of India	(B)	RBI
	(C)	Prime Minister of India	(D)	GST Council
(11)	CCT	ic not applicable on		
(11)		is not applicable on	(B)	Gold
	(A)	Tobacco Ponk Charges	(D)	Petrol
1	(C)	Bank Charges	(L)	1000
(12)	The	ultimate burden of GST is on _		
	(A)	Manufacturer	(B)	Retailer
	(C)	Government	~(D)	End Consumer